

શહેરમાં બેવડી ઝતુનો અનુભવ

છેલ્લા ઘણા દિવસોથી આકરી ઢંડીમાં રાહત મળી હતી પરંતુ લઘુતમ તાપમાન
એક જ દિવસમાં સાડા ચાર ડીગ્રી જેટલુ ઘટતા ઢંડીની અસર વર્તાઈ

ગાંધીનગર, તા. ૧૫
ગાંધીનગરમાં પુનઃ પદ્ધતી આવ્યો
છે. એક તબક્ક ૧૭ ડિગ્રીથી વધુ
પહોંચી ગવેલું લઘુતમ તાપમાન
ગઈ કાલે પુનઃ વધી ગયું હતું અને
પારો સાડા ચાર ડિગ્રી જેટલો
ઘટીને ૧૩ ડિગ્રીએ પહોંચી ગયો
હતો જેણા કરાશો ઢંડીનો થોડો
ચમકાતું અનુભવાનો હતો.
કેદ્ભુઅરી માસના
પ્રારંભથી જ વાતાવરણમાં

કેરકાનો પારંપરા થયો છે. છેલ્લા
ઘણા દિવસોનો આકરી ઢંડીમાં
ખુલ્લું નગરજનોને રાહત મળી
હતી. લઘુતમ અને મહત્વમાં
તાપમાન વધતું ગરવી લગવા
માંડી હતી. પણ આને કુલર શરૂ
થઈ ગયા હતા. ઉનાંથી શરૂ થઈ
ચૂક્કો છે અનુભુતિ વધું હતું.
દિવસે તો સ્થૂનોને તડકો એટલો
આકરો લાગો હતો કે ચામડી
બળી જાય. આ દરમાન જ
ગવેલું લઘુતમ તાપમાન ઘટીને
ઉત્તરાભરતના પરંતીય

વિસ્તરણોમાં નેવસરથી બદ્ધવર્ષાં
થાંને અસર હતી. કંડા પવનો પણ
વર્તાઈ હતી. કંડા પવનો શરૂ થઈ
જતા તાપમાનનો પારો ફિટાફ
નીચે ઉત્તરવાં લાગ્યો હતો.
એક જ દિવસમાં લઘુતમ
તાપમાનમાં સાડા ચાર ડિગ્રી
જટલો થાંને લઘુતમ
તાપમાન ૧૩ ડિગ્રી જેટલું નોંધાય
થતું. ૧૩ ડિગ્રી જેટલું ચામડી
બળી જાય. આ દરમાન જ
ઉત્તરાભરતના પરંતીય

વાતાવરણમાં લઘુતમાં લઘુતીક ઢંડક
અનુભવાઈ હતી. કંડા પવનો પણ
વર્તાઈ હતી. કંડા પવનો શરૂ થઈ
જતા તાપમાનમાં અસરવાય
હતા. વાતાવરણમાં અસરાનો
અસરાંપ કેરકાની બેન્ડી ઝતું
અનુભવ થયો હતો.
ઓં કે મહત્વમાં તાપમાન તો
૨૮.૫ ડિગ્રી. જેટલું ઉચ્ચ રહેતા
સારી એવી ગરમી અનુભવાઈ
હતી. આગામી દિવસોમાં હજુ
ગરમી વધું તેવી આગામી
હવામાન વિભાગે કરી છે.

કેદ્ભુઅરી માસના અંતે કાળજાળ ગરમી પડશે

વાતાવરણમાં હાલના તખ્બ વારવાર કેરકાન આવી રહા છે ત્યારે આ માસના અંતે કાળજાળ ગરમી પડશે આપારં થશે એવી આગામી જીવિતી હવામાનશરીર અંબાવામ દા. પટેલે કરી છે. હાલમાં હવામાનમાં
પલબો આપેલ છે અને વાદળો થવામાં છે. હજુ પણ આગામી દિવસોમાં હવામાન પલટાય અને વાદળો આવે
તા. ૧૩થી ૨૧ માં હવામાનમાં પલબો આવે અને વાદળો આવે. તા. ૨૧, ૨૨ કંડા પવનો હૃદય. આ
અરસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ દિમરવાણી સંભાવના રહે. તા. ૨૪ થી ૨૭ કેદ્ભુઅરીમાં
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારતીય હવામાનાની ભાગોમાં ક્રોસમાં
વરસાની શક્યતા રહે. જ્યારે રાહયાના ભાગોમાં તા. ૨૭ થી ૨૮ માં ગરમી પડવની શક્યતા રહે. કોઈ
કોઈ ભાગોમાં મહત્વમાં ઉત્તોનામાં ૧૦ ડિગ્રી સેલ્વિયસ જેણું થાંથી શક્યતા રહે. જ્યારે મધ્ય જુગરાતના
ગરમોમાં મહત્વમાં ઉત્તોનામાં ૩૭ ડિગ્રી સેલ્વિયસ આસપાર રહેવાની શક્યતા રહે. કેટલાક ભાગોમાં
ઉત્તોનાની અહેવાસ થાય. આ અરસમાં રાહયાના ભાગોમાં પણ મધ્ય માસનાં રાહયાના ભાગોમાં ક્રોસમાં
વરસાની શક્યતા રહે. અને થીરે થીરે ગરમી વધતી જાય. રિવાકો માટે તા. ૨૦ પછી હવામાન સાનુક્કુણ
રહે જ્યારે કેદ્ભુઅરીના અંતમાં ગરમીની શક્યતા રહે.

એકતા સમિતિ દ્વારા
એલ.આર.ડી.
ભરતી અન્યાય
સંદર્ભ બહેનોના
ઉપવાસ આંદોલનને
સંપૂર્ણ ટેકો

ગાંધીનગર, તા. ૧૫
ગાંધીનગર ખાતે મળેલી
અસરી, એસરી, આબીસી અને
માઠીનોરીટી સમાજના
અંતોલાની મળેલ બેઠકમાં
સત્યાગ્રહ થાયા ખાતે મળેલો
દ્વારા ચાલાવણમાં આવેલ
ઉપવાસ આંદોલનને એકતા
સમિતિ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર
કરવામાં આવે છે. તા. ૧૬
કેદ્ભુઅરીના રોજ એવેલારી
ભરતીના અન્યાયમાં
ચાલાવણમાં આવેલ ઉપવાસ
આંદોલનાં એકતા સમિતિ
સવારે ૮ વાગ્યે છજીનો સાથે
ઉપવાસ આંદોલનમાં જોડોશે.

આજે

ડૉ. રષ્મિકાંત મહેતાના

પુસ્તક 'અમર
વારસ'નું લોકપણ

ગાંધીનગર, તા. ૧૫
શહેર દ્વારા જાણીતા
શિક્ષણવિદું અને ગાંધીનગર
સમાચારના કટાર બેઠક ડૉ.
રષ્મિકાંત પી. મહેતાના પુસ્તક
'અમર વારસ'નું લોકપણ
જાણીતા સહિત્યકાર ને કાંઈ
માયેશ જહાન વરદ હસ્તે
યોજાશે. જ્યારે ટીચર્સ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ
પટેલ સમારોહના અથક પદ
રહેશે. આ સમારોહ સાંજે ૪
કલાક, વરપોંખી ૮, ૧૫ કલાક,
હસ્તેખાંગ સવારે ૧૧.૧૫ કલાક
તથા કન્યાવિદ્યાધ પરોંદે ૩.૩૦

અક્રમસમાતમાં ઘાયલને મનપાના સ્ટે.ક્રમિટી ચેરમેને સારવાર માટે મોકલી આપ્યો

ગાંધીનગર, તા. ૧૫
ગાંધીનગર શહેર મહાનગર પાલિકાના
સ્ટેન્નીગ ક્રમિટીના ચેરમેન દેવન્પ્રિલ ચાવડા
(જગાલાપુ) અને રીક્ફ કાપર ઓફિસર મહેતાના



ગતરોજ રાત્રીના સુમારે લઘુતીયાં આપવા
માટે જરૂર રહા હતા. તે સમયે ઘ-થ-થ કંઈતના

કાપર ઓફિસરના સેવાકાર્યને હાજર સૌ

નાગરીકોને બિરદાયનું હતું.

ઉત્તર દશકોઈ કડવા પાટીદાર સુધારક મંડળનો ૨૮મો સમુહ લગ્નોત્સવ યોજાશે

ગાંધીનગર, તા. ૧૫
ઉત્તર દશકોઈ કડવા પાટીદાર સુધારક મંડળનો ૨૮મો સમુહ લગ્નોત્સવ યોજાશે
પાટીદાર સમાજ સુધારક મંડળ એક દાર્શનિક પદ
'અમર વારસ'નું લોકપણ
જાણીતા સહિત્યકાર ને કાંઈ
માયેશ જહાન વરદ હસ્તે
યોજાશે. જ્યારે ટીચર્સ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદ
પટેલ સમારોહના અથક પદ
રહેશે. આ સમારોહ સાંજે ૮.૧૫ કલાક
કલાક, વરપોંખી ૮, ૧૫ કલાક,
હસ્તેખાંગ સવારે ૧૧.૧૫ કલાક
તથા કન્યાવિદ્યાધ પરોંદે ૩.૩૦

વાગ્યે યોજાશે. આ સમુહ
લગ્નોત્સવમાં અને બાગડ ન
થાં તે માટે પ્રયાસ કરીશું. આ
સંદર્ભમાં પણ વાગ્યે
એક દિવસમાં પણ વાગ્યે
એક દિવસમાં અને બાગડ ન
થાં તે માટે પ્રયાસ કરીશું. જ્યારે
એક દિવસમાં અને બાગડ ન
થાં તે માટે પ્રયાસ કરીશું. આ
સંદર્ભમાં એક દિવસમાં
અને બાગડ ન થાં તે માટે પ્રયાસ
કરીશું. એક દિવસમાં અને
બાગડ ન થાં તે માટે પ્રયાસ
કરીશું. એક દિવસમાં અને
બાગડ ન થાં તે માટે પ્રયાસ
કરીશું. એક દિવસમા